

## કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ દ્વારા આયોજીત ખેડૂત દિવસ

કૃષિ અને સહકાર વિભાગ તથા કિસાન કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર નિર્મીત વિભાગીય સજીવ ખેતી કેન્દ્ર, નાગપુર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના અતર્ગત સજીવ ખેતીના પ્રચાર અને પ્રસાર માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન તા.:- ૧૪/૦૭/૨૦૧૬ ના રોજ બારેજડી ગામ ખાતે કરવામાં આવેલ. જેમાં નાગપુર કેન્દ્ર ખાતેથી આવેલ ડૉ. પ્રીયંકા પ્રધાન (વૈજ્ઞાનિક, વિભાગીય સજીવ ખેતી કેન્દ્ર, નાગપુર), ડૉ. ચેતન દેસાઈ (વૈજ્ઞાનિક, એગ્રોનોમી, કે.વી.કે, અરણેજ), શ્રી. મહેશભાઈ પ્રજાપતિ (મદદનીશ ખેતી નિયામક, અમદાવાદ) અને બારેજડી ગામના ૫૦ ખેડૂતોએ ભાગ લીધેલ. આ કાર્યક્રમમાં ડૉ. ચેતન દેસાઈ દ્વારા સજીવ ખેતી પદ્ધતિ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવેલ તેમજ સજીવ ખેતીને લગતા ખેડૂતોને મૂઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ. ત્યારબાદ ખેડૂતોને માંગણીને ધ્યાનમાં રાખીને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બારેજડી ગામમાં ખેડૂત દિવસનું તા.૧૫/૦૭/૨૦૧૬ ના રોજ આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શ્રી દેવાણંદ ગોજીયા (વૈજ્ઞાનિક, કૃષિ ઇજનેર, કે.વી.કે, અરણેજ) દ્વારા ડાંગરના ફેરોપણીમાં આધુનિક સાધનોના ઉપયોગ અને જાળવણી વિશે વિસ્તારથી સમજાવવામાં આવેલ અને તેમા પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવામાં આવેલ. તેમજ ડૉ. ચેતન દેસાઈ દ્વારા બાયોપેસ્ટીસાઇડ બનાવવા માટેની પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન કરાવી તેના ઉપયોગ વિશે વિસ્તારથી સમજાવવામાં આવેલ. વધુમાં ડાંગરના નિરોગી ધરૂ ઉછેરની આદર્શ પદ્ધતિ વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ.



૧. ખેડૂતોને સજીવ ખેતી પદ્ધતિ વિશેષ સમજ આપતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજના વૈજ્ઞાનિક ડૉ. ચેતન દેસાઈ (એગ્રોનોમી).



૨. ખેડૂતોને ડાંગરના ફેરરોપણીમાં આધુનિક સાધનોના ઉપયોગ અને જાળવણી વિશેની આપતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજના વૈજ્ઞાનિક શ્રી. દેવાણંદ ગોજીયા (કૃષિ ઇજનેર)



૩. ખેડૂતોને બાયોપેસ્ટીસાઇડ બનાવવા માટેની પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન કરાવી તેના ઉપયોગ વિશે સમજ આપતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજના વૈજ્ઞાનિક ડૉ. ચેતન દેસાઇ (એગ્રોનોમી).





૪. ખેડૂતો સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓ



૫. બાયોપેસ્ટીસાઇડ બનાવટના પ્રત્યક્ષ નિદર્શન બાદ બાયોપેસ્ટીસાઇડ બનાવતા ખેડૂતો